



COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં સપ્ટેમ્બર 8 થી અમલી બનતા ફેરફારો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 27, 2020) – સીટીના રિઓપનીંગ અને રિકવરી પ્લાનના ભાગરૂપે, મંગળવાર, સપ્ટેમ્બર 8 થી, બસ સર્વિસમાં આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી નીચે મુજબના ફેરફારો કરવામાં આવશે.

સર્વિસમાં ફેરફારો

આપણી ટ્રાન્ઝિટ સિસ્ટમ લોકોને શહેરની આસપાસ કાર્યક્ષમ રીતે હેરફેર કરાવી શકતી હોવાની ખાતરી કરાવવા, નીચેના બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રૂટ્સ સપ્ટેમ્બર 8 થી સંચાલનમાં રહેશે.

- 501 ઝુમ ક્વીન
- 502 ઝુમ મેઈન
- 505 ઝુમ બોવેઈર્ડ*
- 511/511A/511C* ઝુમ સ્ટીવસ
- 1/1A ક્વીન
- 2 મેઈન
- 3/ 3A* મેકલાક્લિન
- 4/4A ચિંગકુસી
- 5/5A બોવેઈર્ડ
- 6 જૈમ્સ પોટર
- 7/7A કેનેડી
- 8 સેન્ટર
- 9 વોડેન
- 10 સાઉથ ઈન્ડસ્ટ્રીયલ
- 11/11A સ્ટીવસ
- 12 ગ્રેનોબલ*
- 13 એવોનડેલ*
- 14/14A ટોરબ્રામ
- 15/ 15A* બ્રેમલી
- 16 સાઉથગેટ*
- 17 હાઉડન*
- 18 રિક્સી
- 19 ફર્નફેરિસ્ટ*
- 20/20A ઈસ્ટ ઈન્ડસ્ટ્રીયલ
- 23 સેન્ડલવૂડ
- 24 વેન કર્ક*
- 26 માઉન્ટ પ્લેઝન્ટ
- 27 રોબર્ટ પાર્કિન્સન*
- 29/29A* વિલિયમ્સ પાર્કવે
- 30 એરપોર્ટ રોડ



- 31 મેક્વીન
- 32 ક્વોર્સ ટોબિન*
- 35 ક્લાર્કવે
- 50/ 50A ગોર રોડ
- 51 હીયરફોર્ડ
- 52 મેક્મર્કી
- 53 રે લોસન
- 54 ક્રાઉન્ટી કોર્ટ*
- 56 કિંગનોલ
- 57 ચારોલેઈસ
- 60 મિસિસાગા રોડ
- 115 એરપોર્ટ એક્સપ્રેસ

*રૂટ્સ સર્વિસ ફરીથી શરૂ.

સમર્પિત સેકન્ડરી સ્કૂલ રૂટ્સ સપ્ટેમ્બર 8 નાં રોજ ફરીથી શરૂ થશે. હાલમાં સર્વિસ ચાલુ હોય તેવા રૂટ્સ અને તેના સમયપત્રકોની યાદી માટે વેબસાઈટ જુઓ, www.bramptontransit.com અથવા કોલ કરો, 905.874.2999

એક રિમાઈન્ડર તરીકે, બ્રેમ્પટન ગેટવે અને ડાઉનટાઉન ટર્મિનલ્સમાં ટર્મિનલ બિલ્ડિંગના કામકાજના ક્લાકો સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી છે. ટ્રિનિટી કોમન ટર્મિનલ બંધ રહે છે. ટર્મિનલ્સમાં ગ્રાહક સેવાના ક્લાકો માટે વેબસાઈટ જુઓ, www.bramptontransit.com.

COVID-19 સુરક્ષા ઉપાયો

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય દર 48 ક્લાકે તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકો ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 ક્લાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજ દા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સીટી ઉતારુઓને માર્ક પહેર્યો હોય તો પણ, ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું ચાલુ રાખવાની વિનંતી કરે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે, પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનિટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવવામાં આવે છે. જો તમે બીમાર હો તો, કૃપા કરી ટ્રાન્ઝિટમાં સવારી કરવાનું ટાળો, સૌથી નજીકની COVID-19 એસેસમેન્ટ સાઈટ પર પરીક્ષણ કરાવો અને જાહેર આરોગ્ય સૂચનો અનુસરો.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, ઉતારુઓને યાદ અપાવવામાં આવે છે કે બસોમાં અને ટર્મિનલ્સ પર નોન-મેડિકલ માર્સ્ક્સ પહેરવા અનિવાર્ય બને છે. સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ટપણે કામ કરી રહ્યાં છે.

અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.



BRAMPTON

Service and Information Update

मिडिया संपर्क

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अँड कम्युनिटी अँगेजमेन्ट

व्यूहान्मक संवाह

सीटी ओफ् ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca